

નર્મદા વન વિભાગ ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭

સાદર જાણાવવાનું કે, નર્મદા વન વિભાગ દ્વારા યુવકો/યુવતીઓ માટે નીચે દર્શાવેલ અનેકવિધ હેતુઓ સિધ્ધ થાય તે માટે સરસ મજાનાં ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭ નું આયોજન કરવામાં આવેલ છે.

ટ્રેકર્સ પ્રકૃતિની સુંદરતાનો પરીચય મેળવે, પ્રકૃતિનાં સૌંદર્યને કેમેરામાં કેદ કરવા, તેમની શારીરિક ક્ષમતામાં વધારો થાય, તેઓ જંગલનું મહત્વ સમજે, તેમનામાં વન સંરક્ષણ અને સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની લાગણીનું બીજાંકુરણ થાય, રવિવારની રજાને ઉજવણીમાં ફેરવી શકે, જંગલનાં વૃક્ષો ઓળખતા થાય, જંગલમાં વસતા આદિવાસીઓનાં ઉત્થાન માટે યોગદાન આપવાની ભાવનાં વિકસે.....

આ ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭ ની વિશેષતા એ છે કે, ટ્રેકીંગ કરવા ઈચ્છુક ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ આ સાથે સંકળાયેલ તમામ કામગીરી પેપરલેસ કરીને એક નવો જ ડીજીટલ અભિગમ વ્યાપાર વન વિભાગ દ્વારા અપનાવવામાં આવેલ છે. તેમજ WhatsApp, Facebook દ્વારા જ આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરીને, ઈન્ટરનેટના માધ્યમથી ટ્રેકર્સ પોતાના મોબાઇલ તેમજ લેપટોપ દ્વારા Online રજીસ્ટ્રેશન કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

વિશેષમાં આ ટ્રેકીંગ પ્રોગ્રામમાં સહભાગી બનતા ટ્રેકર્સ જંગલનું મહત્વ તથા જંગલમાંથી ઉપલબ્ધ થતી વન ઔષધિઓનાં ઉપયોગ વિશેની માહિતી જંગલમાં વસતા આદિવાસી પાસેથી જાણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

વિશેષ આ ટ્રેકીંગ ફેસ્ટીવલ-૨૦૧૭ માં

ટ્રેકર્સને પ્લાસ્ટીકનો ઉપયોગ મર્યાદિત કરવા,
જરૂરીયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવા,
સારી વાતોને એપ્રીશીયેટ કરવાની સુટેવ કેળવવા,
ડીજીટલ મીડીયાનો Positive ઉપયોગ કરવા,
ટાઈમ મેનેજમેન્ટનાં મહત્વ.....

વિશે પણ પ્રેરણારૂપ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ઉપરાંત આ ટ્રેકીંગ પ્રોગ્રામની સાથે સાથે ટ્રેકર્સ દ્વારા ટ્રેકીંગ દરમ્યાન કેમેરામાં કેદ કરવામાં આવેલ ફોટોગ્રાફ્સની Photo Compition તથા એકબીજાનાં ફોટોગ્રાફ્સ ગુગલ ડ્રાઈવમાં Share કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ટ્રેકર્સનાં ફિડબેક પણ Online મેળવવામાં આવી રહ્યા છે.

આ વિશિષ્ટ કાર્યક્રમ આપશ્રીની કચેરીનાં તમામ સ્ટાફને સહભાગી બનવા અમે આમંત્રણ પાઠવીએ છીએ. કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા નીચે ઉપલબ્ધ કરાવેલ રજીસ્ટ્રેશન લીંકમાં રજીસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે. અન્ય તમામ વિગતો રજીસ્ટ્રેશન લીંકમાં ઉપલબ્ધ છે.

રજીસ્ટ્રેશન લીંક :- <https://goo.gl/forms/gJ2qYAPpk2mzbhcf1>



નર્મદા વન વિભાગ



Trekking Festival - 2017 Route Details

ટ્રેક નંબર	તારીખ	ટ્રેક રૂટ	હાજર થવાનું સ્થળ	ટ્રેક કિ.મી.
" Kashmir of Gujarat "				
1	17/09/2017	ઝરવાણી - ટુંગાઈ ફીલ્ડ - ઝરવાણી	ઝરવાણી ઈએ.ટુરિઝમ સેન્ટર	12
" Rajdhani Trek "				
2	24/09/2017	જીતગઢ - જુનારાજ - જીતગઢ	જીતગઢ ચેક પોસ્ટ	18
" Holy Trek "				
3	01/10/2017	માંચ ચોકડી - દેવમોઝરા - માંચ ચોકડી	માંચ ચોકડી નર્સરી	18
" Maze in The Forest "				
4	08/10/2017	ધાંટા - દાતણ આમલી - છટવાડા	ધાંટા ગામ	15
" Trek to The Highest Peak "				
5	15/10/2017	પીપલોદ - ધામણમાલ	પીપલોદ ફોરેસ્ટ ઓફિસ	18
" Into The Dense Forest "				
6	22/10/2017	ઝીચડ - ચોપડી - ઝીચડ	ઝીચડ ચોકડી	15
" Beauty of waterfall "				
7	29/10/2017	ભેકટી - નિનાઈ ધોધ - ભેકટી	ભેકટી	16
" Polo ground on The Top "				
8	05/11/2017	સગાઈ - દેવ ડુંગરી - સગાઈ	સગાઈ ઈએ.ટુરિઝમ સેન્ટર	12
" Beauty of Springs "				
9	12/11/2017	ફુલસર - ટુંકનેર - ફુલસર	ફુલસર રાઉન્ડ ઓફિસ	18
" Roller Coastar in the Forest "				
10	19/11/2017	દેવમોઝરા - પાનાઘાટ - દેવમોઝરા	દેવમોઝરા રાઉન્ડ ઓફિસ	12
ટેકનિકલ માર્ગદર્શન માટે સંપર્ક નંબર - (1) વિષ્ણુભાઈ - 9408550130 (2) સંજયભાઈ - 9714298085				